



BCI-1601250101051301 Seat No. _____

B. A. (Sem. V) (CBCS) (W.E.F. 2016) Examination

August - 2021

Economics

(Quantitative Techniques & Research Methodology-1)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર આપો.

- 1 માહિતીના એકત્રીકરણની પ્રક્રિયામાં સંશોધકની ભૂમિકા અંગે ચર્ચા કરો. 14
- 2 સંશોધનનો ખ્યાલ સમજાવો. સંશોધન સમસ્યાના નિર્ધારણમાં જિજ્ઞાસા વૃત્તિનો ફાળો ચર્ચો. 14
- 3 નિદર્શનો અર્થ સમજાવો. નિદર્શની વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરો. 14
- 4 ક્ષેત્રીય કાર્યકરની પસંદગી અને પ્રશિક્ષણ અંગે ચર્ચા કરો. 14
- 5 સંશોધનમાં પ્રાથમિક માહિતીની ઉપયોગિતા અને મર્યાદાઓ જણાવો. 14
- 6 માહિતી વિશ્લેષણનો ખ્યાલ સમજાવી તેના વિવિધ સોપાનો જણાવો. 14
- 7 વિધેય એટલે શું ? માંગ વિધેય ઉદાહરણ આપી સમજાવો. 14
- 8 અતિવલય (hyperbola)નો ખ્યાલ ઉદાહરણ અને આલેખ દ્વારા સમજાવો. 14
- 9 ટૂંકનોંધ લખો : 14
(1) પુરવઠા વિધેય
(2) ગૌણ માહિતીના વિવિધ સ્ત્રોતો
- 10 ટૂંકનોંધ લખો : 14
(1) નમૂના પસંદગીમાં થતી ભૂલો
(2) સંશોધનની આચારસંહિતા.

ENGLISH VERSION

- Instructions :** (1) All questions carry equal marks.
(2) Attend any Five Questions.

- | | | |
|----|---|----|
| 1 | Discuss the role of researcher in data collection process. | 14 |
| 2 | Explain the concept of research. Discuss the role of curiosity in problem formation. | 14 |
| 3 | Explain meaning of sampling. Discuss various techniques of sampling. | 14 |
| 4 | Discuss about the selection and training of field workers. | 14 |
| 5 | State importance and limitations of primary data in research. | 14 |
| 6 | Explain the concept of data analysis and state various steps of it. | 14 |
| 7 | What is function ? Explain demand function with illustration. | 14 |
| 8 | Explain the concept of hyperbola with illustration and graph. | 14 |
| 9 | Write Short Notes :
(1) Supply Function.
(2) Various sources of secondary data. | 14 |
| 10 | Write Short Notes :
(1) Errors in sampling.
(2) The conduct of Research. | 14 |